



B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

જા.નં. /૨૦૨ -૨૦૨

Minutes of the Meeting

તારીખ : ૨૦/૬/૨૦૨૨

| Title: IQAC Meeting | Meeting No: 01/2022-23 |
|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|----------------------------------------------------------------------------------------------------------------|
| Objectives: <ol style="list-style-type: none">1. Review of Previous Year Progress2. Promote the innovative methods of teaching and learning3. Incorporate stake-holders' input in governance4. Inculcate value system in students5. Suggest measures for improvement | Mtg. Leader: Principal Mtg. Facilitator: IQAC Coordinator Where: Principal's Office |
| | Date: 20 June, 2022 |
| | Start Time: 11:00 a.m. |
| | End Time: 12.20 p.m. |

Attendees:

| Name | Signature | Name | Signature |
|-----------------------------------------------------------|-----------|-----------------------------------------------------|-----------|
| Dr.D.H.Joshi (Principal) | | Dr. Marinaben Chauhan (HOD, Department of Gujarati) | |
| Prof. D.R. Mehta (HOD, Department of English) | | | |
| Shri Mahendrabhai V. Shah (Secretary, Management Council) | | | |
| Dr. J.J.Desai | | | |
| Prof. J.R.Suthar | | | |
| Dr.M.A.Kathiyara (HOD, Department of Psychology) | | | |
| Prof. M.H.Makwana (HOD, Department of History) | | | |
| Prof.J.S. Vadher (HOD, Department of Economics) | | | |
| Shri Jayeshbhai B. Patel (OS) | | | |



PRINCIPAL
SHRI S.K. SHAH & SHRIKRISHNA
O.M. ARTS COLLEGE, MODASA



B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

જા.નં.

Agenda: 2022 -2022


તારીખ : 20/6/2022

1. Action plan for all departments, clubs and forums
2. Submission of AISHE for NAAC Accreditation
3. Analyzing NAAC accreditation works
4. Provide motivation to the students for writing research papers
5. Strategic Plan for NAAC accreditation
6. Any other point with the permission of the chair

Decisions Made/ Information Given:

| | |
|---|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| 1 | IQAC decided to submit AISHE report for Naac Accreditation. All HoD's and coordinators directed to complete the documentation works for accreditation. |
| 2 | IQAC Coordinator Dr.P.R.Sinh elucidated the NAAC accreditation works. A blueprint was drawn up of how each faculty member should work for the accreditation and its further procedures were also discussed. |
| 3 | In the meeting IQAC suggested all HoD's to prepare to conduct more certificate courses for students and the responsibilities were assigned to different teachers. |
| 4 | Departmental planning for conducting seminar and workshops. |
| 5 | Motivate the faculties to publish their research papers in UGC listed journals. |




PRINCIPAL
SHRI S.K. SHAH & SHRIKRISHNA
O.M. ARTS COLLEGE, MODASA

- Grant Code No. : 125
- College Code No. 30 (D.P.)
- Zone Code No. : 93



Prin. Dr. D. H. Joshi
Mob. : 90330 93623
E-mail : skshaharts60modasa@gmail.com

B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

જા.નં. /૨૦૨ -૨૦૨

તારીખ : ૨૦૧૬ /૨૦૨૨

| New Action Items | | | |
|------------------|----------------------------------------|---------------------|--------------|
| # | Item | Responsible | Closing Date |
| 1 | Action Plan | HoDs & Coordinators | 30-06-2022 |
| 2 | Certificate Courses | Coordinators | 15-12-2022 |
| 3 | Proposal for New Courses | Principal | 30-07-2022 |
| 5 | Code of Conduct awareness for students | Dr. J.J.Desai | 15-08-2022 |
| 6 | NAAC Accreditation Works | Dr. P.R.Sinh | 31-10-2022 |

Co-Ordinator
Internal Quality Assurance Cell (IQAC)
Shri S. K. Shah & Shrikrishna O.M.Arts College
Modasa-383315
Dist.Aravalli.,Gujarat



Principal
Shri S. K. Shah & Shrikrishna
O.M.Arts College
Modasa, Dist. Aravalli

PRINCIPAL
SHRI S.K.SHAH & SHRIKRISHNA
O.M.ARTS COLLEGE MODASA



B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

જા.નં. /૨૦૨ -૨૦૨

Minutes of the Meeting

તારીખ : 14 / 7 / 2022

| | | |
|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-------------------------------|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| Title: IQAC Meeting | | Meeting No: 02/2022-23 |
| Objectives: <ol style="list-style-type: none">1. Review of Previous Research Work2. Formulate strategies for all-round development of the college3. Develop and prescribe the quality standards in the delivery of the academic and non-academic programmes4. Promote the innovative methods of teaching and learning5. Inculcate value system in students6. Suggest measures for improvement | | Mtg. Leader: Principal Mtg. Facilitator: IQAC Coordinator Where: IQAC Conference Hall Date: 14 July 2022 Start Time: 3.00 p.m. End Time: 4.00 p.m. |
| Attendees: | | |
| Name | Designation | Signature |
| Dr.D.H.Joshi | Principal | |
| Dr.P.R.Sinh | IQAC Coordinator | |
| Prof. D.R. Mehta | HOD, Department of English | |
| Dr. J.J.Desai | HOD, Department of Sanskrit | |
| Dr.M.A.Kathiyara | HOD, Department of Psychology | |
| Prof. M.H.Makwana | HOD, Department of History | |
| Prof.J.S. Vadher | HOD, Department of Economics | |
| Dr. M. M. Solanki | Assistant Professor | |
| Shri Jayeshbhai B. Patel | OS | |



PRINCIPAL
SHRI S.K. SHAH & SHRIKRISHNA
O.M. ARTS COLLEGE, MODASA

- Grant Code No. : 125
- College Code No. 30 (D.P.)
- Zone Code No. : 93



Prin. Dr. D. H. Joshi
Mob. : 90330 93623
E-mail : skshaharts60modasa@gmail.com

B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

જા.નં. /૨૦૨ -૨૦૨

તારીખ : 14/7/2022

Agenda:

1. Review of the minutes of the last IQAC Meeting and subsequent action taken
2. Organizing NET Coaching Camp for students
3. Criteria wise discussion on NAAC Accreditation
4. Motivation for Research and Publication
5. Any other point with the permission of the chair

Decisions Made/ Information Given:

| | |
|---|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| 1 | IQAC appreciated the qualified students and advised the Career Guidance cell and Placement Cell to conduct more coaching for new students. It also helped in framing quality among the students. |
| 2 | IQAC Coordinator Dr. P.R.Sinh read the minutes that were approved by IQAC. It included the decisions and the actions made. It followed a transparent and fair feedback system analyzing the evaluation parameters and implementation of best practice system. |
| 3 | The progress of strategy shall be measured from time to time. It was said that the principal along with academic council and the other team members will be the custodians for strategic plan and its deployment. |
| 4 | Discussed the scope of all certificate courses and appreciated all coordinators. It emphasized on the vision and their articulation in every key position to enable students more effective in their career advancement. |
| 5 | The meeting suggested starting a center for Research and Publication for the flexible delivery of contents. |




PRINCIPAL

SHRI S.K.SHAH & SHRIKRISHNA
O.M.ARTS COLLEGE, MODASA

- Grant Code No. : 125
- College Code No. 30 (D.P.)
- Zone Code No. : 93



Prin. Dr. D. H. Joshi
Mob. : 90330 93623
E-mail : skshaharts60modasa@gmail.com

B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)


મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

ખ.નં. /૨૦૨ -૨૦૨

તારીખ : ૧૫ / ૭ / ૨૦૨૨

| New Action Items | | | |
|------------------|-----------------------------|-------------------|--------------|
| # | Item | Responsible | Closing Date |
| 1 | Coaching and Implementation | Dr.P.R.Sinh | 30-11-2022 |
| 2 | Criteria wise activities | Coordinators | 31-01-2022 |
| 3 | NSS Activities | Prof.M.B.Deshmukh | 30-11-2022 |


Co-Ordinator
Internal Quality Assurance Cell (IQAC)
Shri S. K. Shah & Shrikrishna O.M.Arts College
Modasa-383315
Dist.Aravalli.,Gujarat


Principal
Shri S. K. Shah & Shrikrishna
O.M. Arts College Modasa (Aravalli)





B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

Minutes of the Meeting

જા.નં.

/૨૦૨ -૨૦૨

તારીખ : ૧૦/૯/૨૦૨૧

| | | |
|------------------------------------------------------------------------------------------------------------|-------------------------------|-------------------------------------------|
| Title: IQAC Meeting | | Meeting No: 03/2022-23 |
| Objectives: | | Mtg. Leader: Principal |
| 1. Focusing on Research Culture | | Mtg. Facilitator: IQAC Coordinator |
| 2. Develop and prescribe the quality standards in the delivery of the academic and non-academic programmes | | Where: IQAC Conference Hall |
| 3. Promote the innovative methods of teaching and learning | | Date: 10 September 2021 |
| 4. Formulate strategies for all-round development of the college | | Start Time: 11.00 a.m. |
| 5. Formulate internal mechanism for quality checks | | End Time: 12.00 p.m. |
| Attendees: | | |
| Name | Designation | Signature |
| Dr.D.H.Joshi | Principal | |
| Dr.P.R.Sinh | IQAC Coordinator | |
| Prof. D.R. Mehta | HOD, Department of English | |
| Dr. J.J.Desai | HOD, Department of Sanskrit | |
| Dr.M.A.Kathiyara | HOD, Department of Psychology | |
| Prof. M.H.Makwana | HOD, Department of History | |
| Prof.J.S. Vadher | HOD, Department of Economics | |
| Dr. M. M. Solanki | Assistant Professor | |
| Shri Jayeshbhai B. Patel | OS | |



PRINCIPAL
SHRI S.K.SHAH & SHRIKRISHNA
O.M.ARTS COLLEGE, MODASA



B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લ.ગાંધી હિચાઇર ડેવલપ્મી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

જા.નં.

/૨૦૨ - ૨૦૨

તારીખ : 10 / 9 / 2022

Agenda:


1. Reviewing the minutes of the last IQAC Meeting and subsequent action taken
2. Strategic plan for NAAC Accreditation
3. Extension Programs for NAAC accreditation
4. Discussion for conducting National and International Seminars
5. Any other point with the permission of the chair

Decisions Made/ Information Given:


| | |
|---|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| 1 | IQAC Coordinator Dr.P.R.Sinh read the minutes that were approved by IQAC. It included the decisions and the actions made. It followed a transparent and fair feedback system analyzing the evaluation parameters and implementation of best practice system. |
| 2 | All criteria leaders presented the documentation works for NAAC accreditation. IQAC reviewed the documents and appreciated the works. Being the first step towards accreditation, the enthusiastic faculty members brought out the possible detailed strategies and plans. |
| 3 | Implementation of the Strategic plan for NAAC accreditation was discussed in detail. The meeting discussed the progress of NAAC works in detail. The progress of strategy shall be measured from time to time. It was said that the principal along with academic council and the other team members will be the custodians for strategic plan and its deployment. |

New Action Items

| # | Item | Responsible | Closing Date |
|---|----------------------------------------|--------------|--------------|
| 1 | Strategic Plan and Research Activities | Dr. P.R.Sinh | 15-12-2022 |
| 2 | NAAC Documentation and Drafting | Coordinators | 30-12-2022 |


Co-Ordinator
Internal Quality Assurance Cell (IQAC)
Shri S. K. Shah & Shrikrishna O.M.Arts College
Modasa-383315
Dist.Aravalli, Gujarat




Principal
Shri S.K.Shah & Shrikrishna
O.M. Arts College, Modasa (Aravalli)

- Grant Code No. : 125
- College Code No. 30 (D.P.)
- Zone Code No. : 93



Prin. Dr. D. H. Joshi
Mob : 90330 93623
E-mail : skshaharts60modasa@gmail.com

B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

જા.નં. /૨૦૨ -૨૦૨

તારીખ : 15/10/2022

Minutes of the Meeting

| | | |
|------------------------------------------------------------------------------------------------------------|-------------------------------|-------------------------------------------|
| Title: IQAC Meeting | | Meeting No: 04/2022-23 |
| Objectives: | | Mtg. Leader: Principal |
| 1. Develop and prescribe the quality standards in the delivery of the academic and non-academic programmes | | Mtg. Facilitator: IQAC Coordinator |
| 2. Inculcate value system in students | | Where: Principal's Chamber |
| 3. Instill a sense of quality consciousness in all stake-holders | | Date: 15 October 2022 |
| 4. Promote the innovative methods of teaching and learning | | Start Time: 10.00 a.m. |
| 5. Incorporate stake-holders' input in governance | | End Time: 11.00 a.m. |
| Attendees: | | |
| Name | Designation | Signature |
| Dr.D.H.Joshi | Principal | |
| Dr.P.R.Sinh | IQAC Coordinator | |
| Prof. D.R. Mehta | HOD, Department of English | |
| Dr. J.J.Desai | HOD, Department of Sanskrit | |
| Dr.M.A.Kathiyara | HOD, Department of Psychology | |
| Prof. M.H.Makwana | HOD, Department of History | |
| Prof.J.S. Vadher | HOD, Department of Economics | |
| Dr. M. M. Solanki | Assistant Professor | |
| Shri Jayeshbhai B. Patel | OS | |



PRINCIPAL
SHRI S.K. SHAH & SHRIKRISHNA
O.M. ARTS COLLEGE, MODASA

- Grant Code No. : 125
- College Code No. 30 (D.P.)
- Zone Code No. : 93



Prin. Dr. D. H. Joshi
Mob. : 90330 93623
E-mail : skshaharts60modasa@gmail.com

B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

જા.નં. /૨૦૨ -૨૦૨

તારીખ : 15/10/2022

| Agenda: | |
|---------|----------------------------------------------------------------------------|
| 1. | Reviewing the minutes of the last IQAC Meeting and subsequent action taken |
| 2. | Promotion of Research Activities |
| 3. | Discussion on National and International Seminars |
| 4. | Any other point with the permission of the chair |

| Decisions Made/ Information Given: | |
|------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| 1 | IQAC Coordinator Dr.P.R.Sinh read the minutes that were approved by IQAC. It included the decisions and the actions made. It followed a transparent and fair feedback system analyzing the evaluation parameters and implementation of best practice system. |
| 2 | All criteria leaders presented the documentation works for NAAC accreditation. IQAC reviewed the documents and appreciated the works. |
| 3 | IQAC reviewed all activities and suggested improving participation of students beyond the syllabus curriculum to make them ready for the present global scenario. |
| 4 | IQAC suggested conducting National and International Webinars in various departments. It emphasized on the enrollment of students in maximum numbers of seminars, thus establishing a continuous internal assurance in them. It also noticed that the need of attending such seminars would encourage the students in research and development work. |

| New Action Items | | | |
|------------------|------------------------------------------------|--------------|--------------|
| # | Item | Responsible | Closing Date |
| 1 | International and National Seminars/ Workshops | HoDs | 31-03-2022 |
| 2 | Academic Monitoring and Feedback | Dr.J.J.Desai | 15-01-2022 |
| 3 | IIQA Submission | Dr.P.R.Sinh | 30-11-2022 |

Internal Quality Assurance Cell (IQAC)
Shri S. K. Shah & Shrikrishna O.M.Arts College
Modasa-383315
Dist Arvalli, Gujarat



Principal
Shri S.K.Shah & Shrikrishna
O.M. Arts College, Modasa (Aravalli)



B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

જા.નં. /૨૦૨ -૨૦૨

તારીખ : ૧૪/૧/૨૦૨૩

Minutes of the Meeting

| | | |
|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-------------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| Title: IQAC Meeting | | Meeting No: 05/2022-23 |
| Objectives: <ol style="list-style-type: none">Promote the innovative methods of teaching and learningInculcate value system in studentsFormulate internal mechanism for quality checksPromotion of Research and student centric activitiesInstill a sense of quality consciousness in all stake-holders | | Mtg. Leader: Principal Mtg. Facilitator: IQAC Coordinator Where: Principal's Chamber Date: 18 January 2023 Start Time: 3.00 p.m. End Time: 4.00 p.m. |
| Attendees: | | |
| Name | Designation | Signature |
| Dr.D.H.Joshi | Principal | |
| Dr. P. R. Sinh | IQAC Coordinator | |
| Prof. D.R. Mehta | HOD, Department of English | |
| Dr. J.J.Desai | HOD, Department of Sanskrit | |
| Dr.M.A.Kathiyara | HOD, Department of Psychology | |
| Prof. M.H.Makwana | HOD, Department of History | |
| Prof.J.S. Vadher | HOD, Department of Economics | |
| Dr. M. M. Solanki | Assistant Professor | |
| Shri Jayeshbhai B. Patel | OS | |



PRINCIPAL
SHRI S.K.SHAH & SHRIKRISHNA
O.M.ARTS COLLEGE, MODASA



B* GRADE BY NAAC

SHRI S. K. SHAH & SHRIKRISHNA O. M. ARTS COLLEGE, MODASA.

[Run by : Shri M. L. Gandhi Higher Education Society, Modasa.]

શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કોલેજ, મોડાસા

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત

MODASA- 383 315, Dist. Aravalli. (North Gujarat)

મોડાસા - ૩૮૩ ૩૧૫, જિ. અરવલ્લી. (ઉત્તર ગુજરાત)

ખ.નં. /૨૦૨ -૨૦૨

તારીખ : ૧૪/૧/૨૦૨૩

Agenda:

1. Reviewing the minutes of the last IQAC Meeting and subsequent action taken
2. National Webinars of English, Economics and Finance
3. Student centric activities.
4. Any other point with the permission of the chair

Decisions Made/ Information Given:

| | |
|---|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| 1 | IQAC Coordinator Dr.P.R.Sinh read the minutes that were approved by IQAC. It included the decisions and the actions made. It followed a transparent and fair feedback system analyzing the evaluation parameters and implementation of best practice system. |
| 2 | Planning to organize students' centric activities. |
| 3 | IQAC appreciated the Webinars/Seminars conducted by the departments of English, Economics and Islamic Finance and suggested continuing the academic activities in the upcoming academic year. It also ensured the maximum participation of students |

New Action Items

| # | Item | Responsible | Closing Date |
|---|------------------------------------------------|--------------|--------------|
| 1 | Feed back of the students for faculty teaching | Coordinators | 30-11-2022 |
| 2 | How to draft Research Proposals | Dr. P.R.Sinh | 30-11-2022 |

Co-Ordinator

Internal Quality Assurance Cell (IQAC)
Shri S. K. Shah & Shrikrishna O.M Arts College
Modasa-383315
Dist.Aravalli.,Gujarat



Principal
Shri S.K.Shah & Shrikrishna
O.M. Arts College, Modasa (Aravalli)